https://archive.org/details/bk1401/page/n0/mode/1up

2010-06-27 -Imam Shah Bawa Roza -PTR (1401)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

[illegible]

અનુસૂચિ-૧લી

[જુઓ નિયમ-૫]

[illegible]

[illegible]

નકલ અરજી કરનાર તા. [illegible]

અધિકારી

નકલ અરજી આપ્યા તા. ૧૦/૬/૧૦

અધિકારી

નકલ તૈયાર કર્યા તા. ૨૫/૬/૧૦

અધિકારી

નકલ આપ્યા તા. ૨૫/૬/૧૦

અધિકારી

નકલ મેળવનાર તા. [illegible] 27/6/10

અધિકારી

(I)

અનુક્રમ નંબર	ટ્રસ્ટનું નામ	ટ્રસ્ટીઓ અને મેનેજરોનાં નામો અને તેમનાં સરનામાં	[illegible]
૧	૨	૩	
	ઈ-૭૩૮ અમદાવાદ ઈમામશાહ બાવા રોજા સંસ્થાન ઠે. પીરાણા પોસ્ટ ગ્યાસપુર તા. અમદાવાદ	[illegible]	[illegible]

https://archive.org/details/bk1401/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1401/page/n2/mode/1up

2010-06-27 -Imam Shah Bawa Roza -PTR (1401)

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

(I)

નકલ અરજી કરનાર તા. [illegible]

નકલ અરજી આપ્યા તા. [illegible]

નકલ તૈયાર કર્યા તા. [illegible]

નકલ આપ્યા તા. [illegible]

નકલ મેળવનાર તા. [illegible]

[illegible] 27/6/10

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]
૧	૨	૩	
	[illegible]	[illegible]	[illegible]

https://archive.org/details/bk1401/page/n3/mode/1up

realpatidar.com

[illegible]

https://archive.org/details/bk1401/page/n4/mode/1up

realpatidar.com

[illegible handwritten Gujarati text]

realpatidar.com

(4) અનુગામી ટ્રસ્ટી અને મેનેજર નીમવાની રીત	ટ્રસ્ટના ઉદ્દેશો	[illegible]	[illegible]
૪	૫	૬	૭
ગાદીવાળા સૈયદ સાહેબના ગુજરી [illegible] ગાદીવાળા [illegible] [illegible] ગાદીવાળા સૈયદ સાહેબ [illegible] [illegible] મેનેજર ની [illegible]	૧. ઇમામશાહ [illegible] ૨. [illegible] ૩. [illegible] ૪) [illegible] ૫) [illegible] ૬) [illegible]	ઇમામશાહ [illegible] ૧૯૮-૩૯ [illegible]	—

realpatidar.com

realpatidar.com

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
(१८) ६. [illegible] [illegible] ०-१८०		३०. [illegible]-१			
७ [illegible] [illegible] ३-१०० [illegible]		३२ [illegible]-२			
८ [illegible] [illegible] २-२५०		४८- [illegible]			
९ [illegible] [illegible]-५ [illegible] २-६००		१ [illegible] (33) [illegible] ०-२००			
१० [illegible] [illegible]-४ [illegible] ०-८२५		२ [illegible] (33) [illegible]			
११ [illegible] [illegible]-३ [illegible] १-०००		३ [illegible] (33) [illegible]			
१२ [illegible] ७ [illegible]-१ [illegible]-८ [illegible] ०-७०५		४ [illegible] (33) [illegible] ०-०५०			
१३ [illegible] [illegible]-[illegible]		५. [illegible] ३ [illegible] ०-७०५			
१४ [illegible] [illegible] ०-१८०		६ [illegible] (33) [illegible] ०-[illegible]			
१५. [illegible] -१ [illegible] ०-१४०		७ [illegible] २ 33 [illegible]			
१६ [illegible] [illegible]		[illegible] ०-६२५			
१७ [illegible] १. [illegible] ०-२०५		१ [illegible] ३१६००			
१८ [illegible] ०-२५५		[illegible] ३१ ३८९००-००			
१९ [illegible] २०५		(२१) [illegible] ३१७०००/२५			
२० [illegible]-१२ [illegible] ०-५००		[illegible]			
२१ [illegible] ०३२५		(२२) [illegible] ३१२३०२०/३५			
२२ [illegible] ०-४५०		[illegible] ३५६२२७/७८			
२३ [illegible] ०-०७५		३ [illegible] ११०००/-			
२४ [illegible] ३-६००		४ [illegible] ३३३५			
२५ [illegible]-४					
२६ [illegible]-१					
२७ [illegible]-१					
२८ [illegible]-३					
२९ [illegible]-३					

realpatidar.com

(૭)

[illegible]		[illegible]	
કીંમત	રૂ	કીંમત	રૂ
૫ [illegible] કિ. [illegible] [illegible] — ૨૫૦/૫		(33) [illegible] ગુજરાતી [illegible] [illegible] કુલ ફેર-૯ [illegible] ૯ [illegible] ફેરમાં ૧ ફેર [illegible] [illegible] [illegible] ફેરની ગુજરાતી [illegible] ફેર-૧ [illegible] કુલ ફેર નં-૨૭ પર [illegible] [illegible] [illegible] ૬૦૫-૬૦૦ [illegible]	
(29) ૧ [illegible] (ગાડી) — ૩૧૭૫૨૦૮/૮૨		(34) [illegible] ૩૧૨.૧૪૩૦૦/૫ [illegible]	
૨ [illegible] — ૨૨૭૫૮=૦૦			
૩ [illegible] — ૨૩૬૦-૦૦			
૪ [illegible] [illegible] — ૨૭૫૮=૦૦			
૫ [illegible] — ૧૫૯૭=૫૦			
([illegible]) — ૨૦૭૫૬૮=૩૨			
૬ [illegible] — ૩૧૬૩૩૭૭/૩૫			
૭ [illegible] [illegible] [illegible] — ૩૧૬૬૦૮૩/૫			
૮ [illegible] [illegible] [illegible] — ૩૧૧૨૬૪૩૩/૪			
૯ [illegible] [illegible] [illegible] — ૩૧૬૩૬૬૮૦/૮			
(28) ~~[illegible] [illegible] — ૩૧૨૯૦૦૦/૫~~ (33)			
(*) [illegible] [illegible] [illegible] નં-૨૭ [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] નં-૫.૦ ૩૫ ફેર [illegible] [illegible] ૧,૦૮૨૫			

realpatidar.com

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]		[illegible]	[illegible]	[illegible]
૨૦	૨૧	૨૨	૨૩	૨૪	૨૫				
[illegible]	૧	[illegible]				[illegible]	[illegible]		
	૨.	[illegible]					~~[illegible]~~	~~[illegible]~~	~~[illegible]~~
		[illegible]					૪૩	૧-૨૮	૩-૪-૦
		[illegible]			૩/૧૯૦૮		૪૪	૩-૨૨	૭-૨૦-૦
		[illegible]					~~૬૩-૨~~	~~૦-૩૪~~	~~[illegible]~~
		[illegible]					૨૨૮	૦-૨૨	૩-૫-૦
[illegible]	૩	[illegible]			૩/૧૯૦૮		૨૪૬	૧-૨૭	૨૦-૫-૦
		[illegible]					૨૪૭	૧-૪	૪-૧૪-૦
		[illegible]					~~[illegible]~~	~~૦-૨૦~~	~~[illegible]~~
		[illegible]					૨૪૫	૧-૩૨	૫-૬-૦
[illegible]	૪	[illegible]			૩/૧૫૦૦૮		૨૪૮	૨-૨૬	૧-૪-૦
		[illegible]					([illegible]) ૨૬૨	૨-૨	૨-૮-૦
		[illegible]		[illegible]			~~૨૬૨~~	~~૦-૩૭~~	~~[illegible]~~
		[illegible]					૨૬૩	૪-૨૭	૧૨-૦-૦
		[illegible]					૨૬૪	૦-૨૬	૨-૭-૦
		[illegible]					૨૬૫	૦-૨૦	૨-૨૩-૦
		[illegible]					૨૬૬	૨-૪	૦-૮-૦
૫ [illegible]		[illegible]			૩/૧૯૦૮		૨૬૭	૨-૨૨	૩-૮-૦
		[illegible]					૨૬૮	૧-૩૩	૨-૦-૦
૬ [illegible]		[illegible]					૨૬૯	૨-૨૨	૪-૨-૦
		[illegible]					૨૭૨	૪-૩૨	૧-૨-૦
		[illegible]					૨૭૩	૫-૨૨	૩-૯-૦
[illegible]	૭	[illegible]			૩/૧૯૦૮		૨૭૮	૨-૭	૦-૭-૦
		[illegible]					૨૭૯	૧-૩૪	૦-૭-૦
		[illegible] ૨-૨૬					૨૮૨	૦-૧૪	૦-૪-૦

realpatidar.com

૨૮૨	૦-૫	
૨૮૩	૦-૮	૦-૭-૦
૨૮૫	૨-૧૧	૬-૧૧-૦
~~૨૮૬~~	~~૦-૨૪~~	~~૩-૩-૦~~ (૧૬)
૨૮૭	૦-૨૧	૦-૫-૦
૨૮૮	૦-૧૬	૦-૮-૦
~~૨૮૯~~	~~૦-૩૬~~	~~૦-૧૧-૦~~ (૧૬)
૨૯૦	૦-૨૪	૦-૩-૦
૨૯૧	૦-૧૩	૧-૨-૦
૨૯૨	૦-૧૪	૦-૧૧-૦
૨૯૩	૦-૧૪	૦-૮-૦
૨૯૪	૦-૧૦	૦-૩-૦
૨૯૫	૧-૧૫	૬-૧૧-૦
૩૦૭	૫-૦	૧-૪-૦
૩૦૮	૩-૬	૨-૮-૦
૩૦૯	૪-૨	૧-૧૫-૦
૩૧૦	૨-૭	૦-૧૩-૦
૩૧૧	૧-૨૬	૧-૩-૦
૩૧૨	૦-૧૪	૦-૧૧-૦
૩૧૩	૧-૧૪	૧-૬-૦
૩૧૪	૨-૧૧	૦-૧૦-૦
૩૧૮	૧-૨૪	૦-૧૧-૦
૩૧૯	૨-૨	૨-૨-૦
૩૨૦	૧-૩૨	૧૦-૧-૦
૩૨૧	૨-૨-૦	[illegible]
૩૨૨	૨-૨૫	[illegible]
૩૨૩	૧-૧	૩-૪-૦
૩૨૪	૬-૩૬	૩-૨-૦
૩૨૫	૩-૨૫	૩-૫-૦
૩૨૬	૩-૨૫	૩-૨-૦
~~૩૨૭~~	~~૧-૩૨~~	~~૧-૧૦-૦~~ (૧૬)
~~૩૨૮~~	~~૬-૦~~	~~૨-૮-૦~~
~~૩૩૫~~	~~૩-૨૮~~	~~૧-૮-૦~~ (૧૦)
૩૩૭	૪-૪	૦-૧૧-૦
૩૩૮	૫-૨૦	૩-૩-૦
૩૩૯	૧-૨	૧-૧૫-૦
૩૪૦	૩-૩૩	૮-૯-૦
~~૩૪૧~~	~~૧-૧~~	~~૦-૧૮-૦~~ (૫૪)
~~૩૪૨~~	~~૦-૩૧~~	~~૦-૧૪-૦~~ (૫૪)

૩૪૩	૧-૨૯	૭-૬-૦
૩૪૪	૯-૩	૪-૫-૦
૩૪૭	૦-૨૦	૨-૧૪-૦
૩૪૮	૩-૨૦	૫-૧૪-૦
૩૪૯	૨-૧૪	૧૩-૧૧-૦
૩૫૧	૦-૨૦	૨-૧૧-૦
૩૫૨	૨-૧૧	૮-૧૨-૦
૩૫૩	૧૧-૨૯	૧-૧૪-૦
૩૫૪	૦-૩૨	૪-૮-૦
~~૩૫૫~~	~~૦-૩૫~~	~~૪-૩-૦~~ (૧૬)
૩૫૬	૬-૨૩	૧૦-૧૪-૦
૩૫૭	૧-૩	૧-૪-૦
૩૫૮	૦-૧૧	૧-૧૧-૦
~~૩૫૯~~	~~૨-૮~~	~~૧૦-૧૦-૦~~ (૧૪)
~~૩૬૦~~	~~૦-૧૫~~	~~૦-૪-૦~~ (૧૬)
૩૬૨	૦-૧૩	૧-૧૫-૦
~~૩૬૩~~	~~૦-૨૩~~	~~૦-૫-૦~~ (૧૬)
૩૬૪	૧-૧૫	૧-૩-૦
૩૭૦	૨-૬	૩-૮-૦
૩૭૧	૭-૩૩	૪-૨૪-૦
~~૩૭૨~~	~~૩-૨૪~~	~~૨-૦-૦~~ (૧૪)
૩૭૩	૩-૩૨	૩-૫-૦
~~૩૭૫~~	~~૮-૨૨~~	~~૫-૧૪-૦~~ (૧૪)
૩૭૭	૩-૫	૩-૫-૦
૩૭૯/૧	૮-૨૩	૧-૫-૦
૩૭૯/૨	૧૭-૨૨	—
~~૩૯૮~~	~~૪-૩૬~~	~~૧૦-૧૦-૦~~ (૧૪)
~~૪૦૦~~	~~૭-૩૨~~	~~૯-૨-૦~~ (૧૪)
૪૦૨	૧-૨	૨-૩-૦
~~૪૦૩~~	~~૩-૪~~	~~૭-૨-૦~~ (૧૬)
૪૦૭	૩-૧	૬-૯-૦
~~૪૧૦~~	~~૩-૦~~	~~૩-૪-૦~~ (૧૨)
૪૧૧	૫-૩૨	૧૩-૧૫-૦
~~૪૨૦~~	~~૨-૩૮~~	~~૬-૬-૦~~ (૧૬)
૪૨૬	૨-૨૫	૩-૧૪-૦
૪૨૯	૩-૧૦	૪-૧૧-૦
૪૩૦	૩-૪	૬-૦-૦
૪૩૯	૫-૧૭	૧૨-૧૪-૦
૪૪૦	૨-૭	૪-૧૧-૦
૬૨૪	૧-૩૭	૪-૧૫-૦
૬૨૫	૧-૨૬	૩-૧૧-૦
(૧૪) [illegible]	[illegible]	[illegible] (૧૪)
[illegible]	[illegible]	[illegible]

https://archive.org/details/bk1401/page/n11/mode/1up

realpatidar.com

[illegible]

realpatidar.com

[illegible]

realpatidar.com

[illegible]

realpatidar.com

13

[illegible]			[illegible]					
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
૧૬	૧૭	૧૮	૧૯	20	21	22	23	24
	૩૪૬૦૦/-	૩૪૬૦૦/-	૫૦૦/-	૮૦૦૦/-	૮૩૫૦/-	૧૫૮૭	૮૫૩	૩૪૬૦૦/-

realpatidar.com

કબજેદારની [illegible]	કબજાની [illegible]	કબજાની [illegible]	શેરો
૨૫	૨૬	૨૭	૨૮
—	(૧૩) [illegible] (struck through)	—	(૧) હક્ક નં. ૭૪૦/૫૨ (૨) રૂ.૨૨ નોંધ તા.૨૯/૧૨/૫૨ (૩) [illegible] (૪) [illegible] તા.૧૭/૨/૬૦ [illegible] (૨) ફેરફાર ૧૬૬/૫૫ તા.૨૫/૧૦/૫૫ની નોંધ [illegible] (૩૫) ફેરફાર ૧૦/૯૩ તા.૩૨-૩-૯૩ [illegible] (૩) ફેરફાર ૬૬૯/૫૫ તા.૨૭/૧૨/૫૬ની [illegible] (૪) ફેરફાર ૩૦૯/૯૦ તા.૨૨-૫-૯૦ની નોંધ [illegible] (૫) ફેરફાર ૨૫૭/૬૮ તા.૧૬/૩/૬૮ની નોંધ [illegible] (૬) ફેરફાર ૫૨૪/૬૯ તા.૨૫-૭-૬૯ની નોંધ [illegible] (૭) ફેરફાર ૫૨૨/૬૯ તા.૧૨-૫-૭૦ની નોંધ [illegible] (૮) ફેરફાર ૫૨૩/૬૯ તા.૨૯/૧૧/૬૯ની નોંધ [illegible] (૯) ફેરફાર ૭૮૩/૭૦ તા.૩૦/૯/૭૦ની નોંધ [illegible] (૧૦) ફેરફાર ૩૫૦/૭૩ તા.૨૮/૫/૭૩ની નોંધ [illegible] (૧૧) ફેરફાર ૭૯૫/૭૬ તા.૯-૧૧-૭૬ની નોંધ [illegible] (૧૨) ફેરફાર ૯૭૮/૭૯ તા.૫/૯/૭૯ની નોંધ [illegible] (૧૩) ફેરફાર ૯૨૭/૮૫ તા.૧૯/૧૧/૮૫ની નોંધ [illegible] (૧૪) ફેરફાર ૯૦૯/૯૬ તા.૧૨/૦/૯૬ની નોંધ [illegible] (૧૫) ફેરફાર ૨૦૯૦/૯૯ તા.૨૮-૧૦-૯૯ની નોંધ [illegible] (૧૬) ફેરફાર ૩૫૬/૦૧ તા.૯/૫/૦૧ની [illegible] (૧૭) ફેરફાર ૩૮૫/૦૧ તા.૨૭/૫/૦૧ની નોંધ [illegible] ફેરફાર ૩૨૨/૦૭ તા.૨૩/૭/૦૭ની [illegible]

realpatidar.com

[illegible]	[illegible]	[illegible]
૨૮ શેરો	૨૮ શેરો	૨૮ શેરો
[illegible]	[illegible]	[illegible]

આથી દાખલો આપવામાં આવે છે કે
આ પ્રમાણિત નકલ છે
[illegible] ૨૪/૬/૧૦
જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી
અમદાવાદ પ્રદેશ, અમદાવાદ

નકલ ખર્ચ રૂ. [illegible]
મુકાબલ ખર્ચ રૂ. [illegible]
પેપર ખર્ચ રૂ. [illegible]
કુલ ખર્ચ રૂ. [illegible]

નકલ કરનાર [illegible]
મુકાબલ કરનાર [illegible]